



AV-1165

Seat No. _____

B. A. (Sem. IV) Examination

March / April - 2018

Psychology : CE - 404

(Health Psychology - II)

Time : 3 Hours]

[Total Marks : 70

સૂચના : જમણી બાજુના અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

- ૧ નીચેના પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્નનો ઉત્તર લખો : ૧૪
(અ) દર્દી-સહાયકર્તા પ્રત્યાપન (સંદેશાવ્યવહાર) નું સ્વરૂપ સમજાવો.
(બ) દર્દ મટાડનાર ઔષધ તરીકે પ્લેસેબોની વિસ્તૃત ચર્ચા કરો.
- ૨ નીચેના પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્નનો ઉત્તર લખો : ૧૪
(અ) હૃદયનલિકાનો રોગ (CHD) સવિસ્તર વર્ણવો.
(બ) “ડાયાબિટીસ” દીર્ઘકાલીન બિમારી તરીકે તેના પ્રકાર અને સ્વસંચાલનની રીતો સમજાવો.
- ૩ નીચેના પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્નનો ઉત્તર લખો : ૧૪
(અ) દીર્ઘકાલીન માંદગી અંગે દર્દીની માન્યતાઓ શો ભાગ ભજવે છે ? સમજાવો.
(બ) દીર્ઘકાલીન માંદગીમાં મનોવૈજ્ઞાનિક દરમિયાનગીરીઓ વર્ણવો.

- ૪ નીચેના પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્નનો ઉત્તર લખો : ૧૪
- (અ) સ્વાસ્થ્ય સંવર્ધનના કોઈપણ બે ઘટકો સમજાવો.
- (બ) સ્વાસ્થ્ય સંવર્ધનના પ્રયાસ તરીકે મનોભારના વ્યવસ્થાપનને સમજાવો.

- ૫ નીચેના પ્રશ્નોમાંથી ગમે તે સાત પ્રશ્નોના બે થી ત્રણ લીટીમાં ૧૪ ઉત્તર લખો :
- (૧) તંદુરસ્તી સંભાળને સહાયકર્તા કોણ કોણ હોય છે તે જણાવો.
- (૨) સંદેશાવ્યવહારને દર્દી સુધી પહોંચાડવામાં નબળો પાડવામાં કયા ઘટકો ભાગ ભજવે છે ?
- (૩) પ્લેસબો વિશે સમજાવો.
- (૪) કેવી સ્ત્રીઓમાં હૃદયરોગ ઓછો થાય છે ?
- (૫) 'સ્ટ્રોક'ના લક્ષણો જણાવો.
- (૬) 'સ્ટ્રોક'ના પરિણામે ઉદભવતી સમસ્યાઓ જણાવો.
- (૭) દીર્ઘકાલીન માંદગીના આવેગીય પ્રતિભાવ જણાવો.
- (૮) ઈન્કાર શેમાં મદદરૂપ બને છે ?
- (૯) દીર્ઘકાલીન માંદગીની વ્યક્તિગત સમસ્યાઓ જણાવો.
- (૧૦) સ્વાસ્થ્ય મનોવૈજ્ઞાનિક બનવા માટેની લાયકાત જણાવો.
- (૧૧) સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન કોને અગ્રિમતા આપે છે ?
- (૧૨) સ્વાસ્થ્ય મનોવૈજ્ઞાનિકો કયાં કયાં કાર્ય કરે છે. તે જણાવો.